



**NILA
INFRASTRUCTURES
LIMITED**

Nila/Cs/2019/256
Date: August 12, 2019

To,
The Department of Corporate Services
BSE Limited
Phirozee Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai- 400 001

To,
The Listing Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, Plot no. C/1, G Block,
Bandra-Kurla Complex, Bandra (E),
Mumbai - 400 051

Scrip Code: 530377

Scrip Symbol: NILAINFRA


Dear Sir,

Subject: Submission of copies of communication and newspaper publication to the shareholders

The Company had sent communication to those shareholders of the Company whose dividend remained unpaid for seven consecutive years and whose equity shares are liable to be transferred to the Investor Education and Protection Fund (IEPF) in accordance with the provisions of Section 124 (6) of the Companies Act, 2013 read with IEPF (Accounting, Auditing, Transfer and Refund) Rules, 2016. Copies of the communication sent to the shareholders in this connection and newspaper advertisement published in the Business Standard – English and Loksatta Jansatta – Gujarati edition dated August 10, 2019 are enclosed herewith.

Kindly take the same on record.

Thanking you,
Yours faithfully,
For, Nila Infrastructures Limited


Dipen Y Parikh
Company Secretary



Encl: a/a

Registered Office:

1st floor, Sambhaav House
Opp. Chief Justice's Bungalow
Bodakdev, Ahmedabad 380015
Tel.: +91 79 4003 6817 / 18, 2687 0258
Fax: +91 79 3012 6371
e-mail: info@nilainfra.com



NILA INFRASTRUCTURES LTD.

CIN: L45201GJ1990PLC013417

Registered Office: First Floor, Sambhaav House; Opp: Chief Justice's Bungalow;
Bodakdev, Ahmedabad – 380015

Tele: 079-40036817/18; 26870258; Fax: 079-30126371; Email: secretarial@nilainfra.com; Website: www.nilainfra.com

Date:

Dear Shareholder(s),

Sub: TRANSFER OF EQUITY SHARES TO INVESTOR EDUCATION & PROTECTION FUND [IEPF] AUTHORITY

Pursuant to the provisions of Section 124(5) of the Companies Act, 2013, the dividend amount remaining unpaid or unclaimed for a period of seven years, from the day they became due for payment, are required to be transferred by the Company to the Investor Education and Protection Fund [“IEPF”] established by the Central Government. The Company has been regularly uploading on its website and the website of Ministry of Corporate Affairs, full details of such amount of unpaid or unclaimed dividend.

Now, Pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (“the Rules”) notified by the Ministry of Corporate Affairs as amended from time to time and Regulation 39(4) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is required to transfer all equity shares in respect of which dividend remains unpaid or unclaimed for a period of seven consecutive years to the demat account of IEPF Authority set up by the Central Government, in the manner as prescribed under the Rules.

In this connection please note that the dividend for FY 2011-12 will be transferred to IEPF Authority unless the shareholder claims the unclaimed dividend on or before October 21, 2019.

Further all such shareholders who has yet not claimed their unpaid dividend for all the seven consecutive years starting from FY 2011-12 are requested to make an application to the Company for claiming their unpaid dividend by October 21, 2019 failing which the shares will be transferred to the IEPF Authority, without any further notice. In order to claim the unclaimed Dividend of previous years lying with the Company, please send a written application along with self-attested copy of PAN card and the original unencashed Dividend Warrant at the registered office of the Company.

The Company has uploaded the details of such shareholders, *inter-alia*, Name, Folio No. / DP-Client ID related to shares due for transfer to IEPF Authority on its website: www.nilainfra.com under Investor Section. The Shareholders may further note that the details uploaded by the Company on its website should be deemed to be adequate notice for the purpose of transfer of shares held in demat / physical form to IEPF Authority pursuant to the Rules.

The concerned shareholders may take note that once the shares are transferred to IEPF Authority pursuant to provisions of the Rules, the original Share certificates issued in respect of said shares shall stand cancelled and will have no validity. It may also be noted that the shares transferred to IEPF Authority, including all benefits accruing on such shares, if any, can be claimed back from the IEPF Authority after following the procedure prescribed under the Rules. **Please note that no claim shall lie against the Company in respect of unclaimed Dividend amount and Shares transferred to IEPF Authority pursuant to the said Rules.**

For any information/clarification on the above matter, please contact the Company at email ID: secretarial@nilainfra.com or Registrar and Transfer Agent: MCS Share Transfer Agent Ltd.; Second Floor, Shatdal Complex, Opp: Bata Show Room, Ashram Road, Ahmedabad – 380001; Email: mcsstaahmd@gmail.com

Yours Truly,

For, **NILA INFRASTRUCTURES LTD.**

Sd/

Dipen Y. Parikh

Company Secretary

H.G. Infra Engineering Limited
CIN No. - L45201RJ2003PLC018049
Regd Office : 14, Panchwati Colony, Ratanada, Jodhpur-342001 (Rajasthan)
Tel.: 0291-2515321, Email: cs@hginfra.com, Website : www.hginfra.com

Statement of Unaudited Financial Results for the Quarter ended June 30, 2019 (Amount in Rs. Millions)

Sr. No.	Particulars	Standalone			Consolidated				
		Quarter Ended		Year ended	Quarter Ended		Year ended		
		June 30, 2019	March 31, 2019	March 31, 2019	June 30, 2019	March 31, 2019	March 31, 2019		
1	Revenue from operations	5,261.11	5,799.70	4,501.69	20,098.32	5,321.05	5,841.06	4,501.69	20,144.95
2	Profit before tax	526.89	588.37	411.25	1,902.45	572.70	610.60	418.26	1,944.04
3	Profit after tax	344.03	367.41	270.12	1,235.68	379.05	385.80	277.13	1,273.43
4	Total Comprehensive Income for the period	340.23	355.17	269.88	1,222.72	375.25	373.56	276.89	1,260.47
5	Paid-up equity share capital (Face Value of the Rs 10 per share)	651.71	651.71	651.71	651.71	651.71	651.71	651.71	651.71
6	Earnings Per Share (of Rs. 10 per share): Basic and Diluted	5.28*	5.65*	4.14*	18.96	5.82*	5.93*	4.25*	19.54

* Not annualised

The above is an extract of the detailed format of Unaudited Standalone and Consolidated Financial result which is filed with stock exchange under regulation 33 of the SEBI (Listing obligation and disclosure Requirements) regulations, 2015. The full format of the Unaudited Standalone and Consolidated Quarterly financial result are available on the site of BSE Limited (URL: www.bseindia.com/corporate) and national stock exchange of India Limited (URL: www.nseindia.com/corporate) and company's website on www.hginfra.com.

For and on behalf of the Board of Directors
H. G. Infra Engineering Limited
Sd/-
Harendra Singh
Chairman & Managing Director
DIN: 00402458

Place : Jodhpur
Date : August 9, 2019

बैंक ऑफ बड़ोदा Bank of Baroda
India's International Bank

POSSESSION NOTICE
(Immovable property)

Whereas, The undersigned being the Authorised officer of Bank of Baroda, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of Powers conferred under section 13 (2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a Demand Notice dated 09-04-2019 calling upon the borrower Mr. Prafulbhai Majibhai Ajudiya, Smt. Bharti Prafulbhai Ajudiya to repay the amount mentioned in the notice being 95,18,700.86/- (Rupees ninety five Lacs eighteen thousand seven hundred and eighty six paise only) and interest up to w.e.f.29/03/2019 within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 06th day of August of the year 2019.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, Parivar Char Rasta Branch, Vadodara for an amount being 95,18,700.86/- (Rupees ninety five Lacs eighteen thousand seven hundred and eighty six paise only) and interest from 31-03-2019 and other charges.

Description of the Immovable Property

The Immovable Residential property being project/scheme known as AEMENORA being constructed /under construction on land bearing R S no. 2613, Block no 1888 known as AEMENORA block no B/1 Plot admeasuring 142 sq.mtrs i.e. 1528 sq.ft construction admeasuring 169.33 sq.mtrs i.e. 1822 sq.ft of village Mouje Bhayli, Taluka Vadodara District Vadodara. Bounded as under: East : by open space, West : by 7.5 mtrs road, North: by 12 mtrs road, South: by Block No.2. In the Registration District Sub District Vadodara.

Place : Baroda, Date : 10-08-2019
Authorised Officer, Bank of Baroda

OSWAL OVERSEAS LIMITED
CIN No:- L74899DL1984PLC018268
Regd. Office: 72, Ground Floor, Taimoor Nagar, New Delhi - 110 065
Phone No:- 011-41064256, Fax No:- 011-26322664, E-mail :- cs@oswaloverseasitd.com Website: www.oswaloverseasitd.com

EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2019 (Rs. in Lakh)

Sr. No.	Particulars	Quarter ended on 30.06.2019	Quarter ended on 31.03.2019	Quarter ended on 30.06.2018
		Unaudited	Audited	Unaudited
1.	Total income from operations (net)	5084.43	2011.85	2031.28
2.	Net Profit / (Loss) from ordinary activities after tax	-567.75	883.60	-40.15
3.	Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	-567.75	883.60	-40.15
4.	Other Comprehensive income	-1.30	-0.91	0.05
5.	Net Profit/ Loss	-569.05	882.68	-40.10
6.	Equity Share Capital	646.11	646.11	646.11
7.	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-1772.39	-
8.	Earnings Per Share (before extraordinary items) (face value of Rs. 10/- each)			
	Basic :	-8.81	13.66	-0.62
	Diluted:	-8.81	13.66	-0.62
9.	Earnings Per Share (after extraordinary items) (face value of Rs. 10/- each)			
	Basic :	-8.81	13.66	-0.62
	Diluted :	-8.81	13.66	-0.62

The above is an extract of the detailed format of quarterly financial results filed with the stock exchanges under regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirement) Regulation, 2015. The full format of the quarterly financial results is available on the website of BSE Limited and the website of the company (www.oswaloverseasitd.com).

Sugar Industry is a seasonal industry where crushing normally takes place during the period between November and April, while sales are distributed throughout the year. The performances of the company vary from quarter to quarter.

For Oswal Overseas Limited
Sd/-
Paramjeet Singh
(Managing Director)
DIN: 00313352

New Delhi
09.08.2019

Varroc Engineering Limited
Registered and Corporate Office: L-4, MIDC Area, Waluj, Aurangabad 431 136, Maharashtra
CIN: L28920MH1988PLC047335
Tel: +91 240 6653 700/6653 699, Fax: +91 240 2564 540 E-mail: investors@varroc.com

Extract of Unaudited Consolidated Financial Results for the quarter ended June 30, 2019 (Rs. in million)

Sr. No.	Particulars	For the quarter ended		For the year ended
		June 30, 2019	June 30, 2018	March 31, 2019
		Unaudited	Unaudited	Audited
1	Total Income from operations	28,992.42	29,531.77	1,21,272.53
2	Net Profit for the period (before tax)	1,021.38	1,343.11	5,486.64
3	Net Profit for the period (after tax)	874.97	1,004.38	4,497.79
4	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive income (after tax))	939.12	805.72	3,434.31
5	Paid-up equity share capital	134.81	134.81	134.81
6	Other equity of previous year as shown in the Audited Balance Sheet	-	-	30,736.21
7	Basic and diluted Earning Per share (Face value of Rs.1 each) (not annualised)	6.44	7.38	33.11

Notes:

1 Information of Standalone Unaudited Financial Results of the Company are as under:- (Rs. in million)

Particulars	For the quarter ended		For the year ended
	June 30, 2019	June 30, 2018	March 31, 2019
	Unaudited	Unaudited	Audited
Turnover	6,332.90	6,323.31	26,246.37
Profit before tax	263.52	389.28	1,738.74
Profit after tax	187.54	258.27	1,195.40

2 The above Unaudited standalone and consolidated financial information of the Company for the quarter ended June 30, 2019 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on August 09, 2019.

3 The above is an extract of the detailed format of Unaudited standalone and consolidated Financial Results for the quarter ended June 30, 2019, filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended. The full format of Standalone and Consolidated Unaudited Financial Results are available on the stock exchange websites, i.e. www.nseindia.com and www.bseindia.com and on the Company's website i.e. www.varrogroup.com

For and on behalf of
Varroc Engineering Limited
Sd/-
Tarang Jain
Managing Director
DIN - 00027505

Place: Aurangabad
Date: August 09, 2019

NMDC Limited
(A Govt. of India Enterprise)
'Khanij Bhavan', 10-3-311/A, Castle Hills, Masab Tank, Hyderabad-500 028. Telephone:0091-40-23536740, 23538713 to 23538721 Ext:228/535/270/230 Fax:23538781
Email:ksmurthy@nmdc.co.in ; sansari@nmdc.co.in.
CIN : L13100TG1958 GOI001674.

Tender No.: HQMM/3027-18/33XN11/282 Dt: 09.08.2019

GLOBAL TENDER NOTICE Through E-Procurement Mode
E-Tenders are invited for procurement of following Item of NMDC Limited, DIOM Donimalai Complex, Bellary District, Karnataka State :

Description	Pre Bid Meeting	Display & Sale of Tender Documents Period	Last Date & Time for submission of offer	Tender Fee Rs/ US \$	Earnest Money Deposit in Rs/US \$
Procurement of 1 no. WD XRF Spectrometer for Chemical Laboratory	20-08-2019 at 11 AM	DRAFT 10-08-2019 to 20-08-2019 FINAL 01-09-2019 to 17-09-2019	17-09-2019 By 02.30 PM (IST)	Rs. 5900/- OR US \$ 100	Rs. 2,00,000/- OR US \$ 3000

Prospective bidders may visit our website www.nmdc.co.in ; CPP Portal <http://eprocure.gov.in> ; <https://mstccommerce.com> and may download the tender documents and also corrigendum if any. Kindly note that any corrigendum to the above tender notice will not be published and uploaded only on NMDC and MSTC website.

Jt. General Manager (Material)

NILA INFRASTRUCTURES LIMITED
CIN No: L45201G1990PLC013417
Regd Office: 1st Floor, Sambhav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad-380015
Tel: +91 79 4003 6817 /18; Fax: +91 79 2687 3922
Email: secretarial@nilainfra.com, Website: www.nilainfra.com

NOTICE

NOTICE is hereby given that in compliance with the provisions of Section 124 (6) of the Companies Act, 2013 and Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, the Company is mandated to transfer all such shares in the name of Investor Education and Protection Fund (IEPF) Account in respect of which dividends has not been paid or claimed for consecutive seven years or more.

NOTICE is further given that in accordance with the provisions of the IEPF Rules, individual notices have already been sent to respective shareholders at their latest available address in the Company/Registrar and Share Transfer Agent (RTA) records, inter alia providing the details of shares being transferred to IEPF authority and details of such shareholders is also available at the website of the Company www.nilainfra.com.

The concerned shareholders are requested to claim the unpaid/unclaimed dividend amount(s) on or before October 21, 2019 failing which their shares will be transferred to IEPF Authority at appropriate date.

It may be noted that to comply with the aforesaid requirement, the Company will take necessary steps for transfer of unclaimed shares as per the procedure mentioned in the IEPF Rules. After the said shares have been transferred to IEPF, concerned shareholders may claim the said shares from IEPF authority by making an application as per the rules.

For further information/request to claim unpaid/unclaimed dividend(s) /shares, the concerned shareholders may contact to the Secretarial Department of the Company at the above mentioned address.

Date: August 10, 2019 For: Nila Infrastructures Limited
Place: Ahmedabad By order of the Board of Directors
Company Secretary

SHREE RAMA MULTI-TECH LIMITED
Regd. Office : 301, Corporate House, Opp. Torrent House, Income Tax, Ahmedabad-380009
Website: www.srmtl.com, Email : cslegal@srmtl.com, CIN No. L25200GJ1993PLC020880

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2019 (Rs. In Lakhs)

Sr.No	PARTICULARS	Quarter ended 30th June,2019 (Unaudited)	Quarter ended 30th June,2018 (Unaudited)	Year ended 31st March, 2019 (Audited)
1	Total Revenue	3611.81	2505.29	11765.20
2	Net Profit / (loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	156.93	(218.09)	(444.29)
3	Net Profit / (loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	156.93	(218.09)	(444.29)
4	Net Profit / (loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	171.42	9.99	(302.61)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	170.81	13.29	(301.43)
6	Equity Share Capital (Face Value RS.5/- each)	3176.03	3176.03	3176.03
7	Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	(2835.24)
8	Earnings per Share (Basic & Diluted) (Face Value Rs.5/-) (for continuing and discontinued operations)			
	1. Basic	0.27	0.02	(0.48)
	2. Diluted	0.27	0.02	(0.48)

Notes

a) The above Unaudited Financial Results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors in their respective meetings held on 9th August, 2019. The Limited Review as required under Regulation 33 of the SEBI (listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the statutory auditors of the company and the related report is being submitted to the concerned stock exchanges.

b) The financial results for the Quarter ended June 30, 2019 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.

c) The above is an extract of the detailed format of Unaudited Financial Results for Quarter ended June 30, 2019 filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and website of the company (www.srmtl.com)

By Order of the Board of Directors
For, Shree Rama Multi-Tech Limited
Shailesh K. Desai
Managing Director

Place : Moti Bhoyan
Date : 9th August, 2019

BANCO PRODUCTS (INDIA) LIMITED
Regd. Office : Bil, Near Bhaili Rly. Station, Padra Road, Dist. Vadodara - 391 410. Phone : (0265) 2318226, FAX :- 2680433
CIN NO:- L51100GJ1961PLC001039, Website :- www.bancoindia.com, E-mail:- investor@bancoindia.com

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2019 (Rs. in Lakhs)

Particulars	Standalone				Consolidated			
	Quarter ended 30.06.2019 Unaudited	Quarter ended 31.03.2019 Audited	Quarter ended 30.06.2018 Unaudited	Previous Year ended 31.03.2019 Audited	Quarter ended 30.06.2019 Unaudited	Quarter ended 31.03.2019 Audited	Quarter ended 30.06.2018 Unaudited	Previous Year ended 31.03.2019 Audited
Total income from Operations	19,216	20,672	18,184	81,934	40,157	37,268	44,124	157,715
Net profit/(loss) for the period (before tax, exceptional and/or extra ordinary items)	4,198	3,827	2,604	16,460	4,466	3,319	5,410	15,252
Net profit/(loss) for the period before tax (after exceptional and/or extra ordinary items)	4,198	4,760	2,604	17,393	4,466	3,319	5,410	15,252
Net profit/(loss) for the period after tax (after exceptional and/or extra ordinary items)	3,407	3,662	1,618	12,291	2,992	487	3,120	6,908
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	3,391	3,929	1,632	12,617	8,173	1,400	8,404	10,358
Equity Share Capital	1,430	1,430	1,430	1,430	1,430	1,430	1,430	1,430
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	Rs.64,868/-Lakhs as on 31st March 2019				Rs.81,784/-Lakhs as on 31st March 2019			
Earning per share (of Rs. 2/- each) (for continuing and discontinued operations)								
Basic	4.76	5.12	2.26	17.19	4.18	0.68	4.30	9.66
Diluted	4.76	5.12	2.26	17.19	4.18	0.68	4.36	9.66

Note : (1) The above is an extract of the detailed format of the Unaudited Financial Results of the Company for the Quarter ended 30th June, 2019 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended on 30th June, 2019 are available on the website of the SEBI Limited at www.bseindia.com, National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the Company at www.bancoindia.com. (2) The above results (Standalone and Consolidated) have been prepared in accordance with standards (IND AS) notified under section 133 of the companies Act 2013, read together with relevant rules issued there under and other accounting principles generally accepted in India.

Place : Bil
Date : 09.08.2019

For Banco Products (India) Limited
Rajendra J Anandpara
Managing Director

6 AHMEDABAD | 10 / 11 AUGUST 2019 **Weekend Business Standard**

THE WALL STREET JOURNAL.
Read ambitiously

Business Standard
Insight Out

From India to Wall Street and back.
At ₹17,165* less

Get complimentary access to The Wall Street Journal Online with Business Standard Digital.

business-standard.com

Subscribe Now

f bsindia t bsindia

*Conditions apply

